

SPARC/Sec/SE/2025-26/37

November 12, 2025

National Stock Exchange of India Ltd.,
Exchange Plaza, 5th Floor,
Plot No. C/1, G Block,
Bandra Kurla Complex,
Bandra (East), Mumbai – 400 051.

BSE Limited,
Market Operations Dept.
P. J. Towers,
Dalal Street,
Mumbai - 400 001.

Scrip Symbol: SPARC

Scrip Code: 532872

Dear Sir/ Madam,

Sub: Disclosure under Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (“Listing Regulations”)

Pursuant to the provisions of Regulation 47 of the Listing Regulations, please find enclosed the copies of advertisement published on November 12, 2025, the extract of Financial Results (Standalone and Consolidated) of the Company for the second quarter and half year ended September 30, 2025, in Financial Express (English Newspaper) all Editions and Financial Express (Gujarati Newspaper) Ahmedabad Edition.

A copy of the newspaper clippings are attached herewith. These are also being made available on the website of the Company at <https://sparc.life/>

This is for your information and record.

For **Sun Pharma Advanced Research Company Ltd.**

Kajal Damania
Company Secretary and Compliance Officer

Encl: as above

E2E Networks Limited

CIN:- L72900DL2009PLC341980

Awfis, 1st Floor, A-24/9, Mohan Cooperative Industrial Estate,
Mathura Road, New Delhi-110044, Phone No. +91-11-4084-4964
Email: cs@e2enetworks.com, Website https://www.e2enetworks.com/

**Statement of Un-Audited Standalone Financial Results
for the quarter ended September 30, 2025.**

The Un-audited Standalone Financial Results for the quarter ended September 30, 2025 ("Financial Results") have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company in their respective meetings held on Tuesday, November 11, 2025.

The full format of Financial Results is available on the website of Stock Exchange at www.nseindia.com and also on the Company's website at <https://www.e2enetworks.com/investors/financial-information> and can be assessed by scanning the QR code.



For E2E Networks Limited
Sd/-
Srishti Baweja
Whole Time Director
DIN: 08057000

Date: November 11, 2025,
Place: New Delhi

**S CHAND AND COMPANY LIMITED**

Registered Office: A-27, 2nd Floor, Mohan Co-operative Industrial Estate, New Delhi-110044, India
Email: investors@schandgroup.com; Website: www.schandgroup.com; Phone: +91 11 49731800
Fax: +91 11 49731801; CIN: L22219DL1970PLC005400

**Extracts of the Unaudited Standalone and Consolidated Financial Results for the
quarter and half year ended 30th September, 2025**

(₹ in millions)

S. No.	Particulars	Standalone			Consolidated		
		Quarterly		Year Ended	Quarterly		Year ended
		September 30, 2025	September 30, 2024	March 31, 2025	September 30, 2025	September 30, 2024	March 31, 2025
		Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited	Audited
1	Total Income from operations	253.76	335.86	3,099.16	517.83	396.36	7,326.97
2	Profit/(loss) before exceptional items and tax	(199.04)	(115.35)	312.53	(709.33)	(675.79)	928.36
3	Profit/(loss) before tax	(199.04)	(115.35)	223.63	(709.33)	(675.79)	928.36
4	Profit/(loss) for the period/year (after tax)	(139.12)	(85.84)	157.37	(535.94)	(527.68)	602.32
5	Total comprehensive income for the period /year (comprising profit/(loss) and other comprehensive income for the period/year)	(134.74)	(88.54)	153.36	(536.01)	(533.01)	595.12
6	Equity Share capital	176.36	176.09	176.25	176.36	176.09	176.25
7	Reserves and surplus (excluding Revaluation Reserves) of the previous year	NA	NA	8,416.09	NA	NA	9,726.54
8	Earnings/(loss) per share (in ₹)						
	- Basic	(3.94)	(2.44)	4.47	(14.96)	(14.67)	18.04
	- Diluted	(3.94)	(2.44)	4.46	(14.96)	(14.67)	18.03

Notes:

- The above is an extract of detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of The SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Company's website www.schandgroup.com and on the website of BSE Limited (www.bseindia.com) and The National Stock Exchange of India Limited (www.nseindia.com).
- The unaudited standalone and consolidated financial results for the quarter and half year ended September 30, 2025 were reviewed by the Audit Committee at its meeting held on November 11, 2025 and have been approved and taken on record by the Board of Directors at its meeting held on November 11, 2025.



For and on behalf of the Board of Directors
S Chand And Company Limited
Sd/-
Himanshu Gupta
Managing Director
DIN: 00054015

Date: November 11, 2025
Place: New Delhi

**ARTEMIS MEDICARE SERVICES LIMITED**

CIN: L85110DL2004PLC126414

Regd. Office : Plot No.14, Sector 20, Dwarka, South West Delhi, Delhi- 110075
Ph.: +91-124-4511111

Email: investor@artemishospitals.com; | Website: www.artemishospitals.com

**EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND
SIX MONTHS ENDED SEPTEMBER 30, 2025**

(₹ in Lacs)

S. No.	Particulars	Quarter Ended		Half Year Ended		Year Ended
		30-Sep-25	30-Sep-24	30-Sep-25	30-Sep-24	31-Mar-25
		(Unaudited)		(Unaudited)		(Audited)
1	Total Income from Operations	27,470.28	24,142.14	52,966.37	46,462.52	93,691.67
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	3,937.58	3,055.36	6,916.02	5,219.27	10,766.58
3	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	3,937.58	3,055.36	6,916.02	5,219.27	10,766.58
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	3,000.22	2,213.07	5,119.97	3,865.50	8,217.62
5	Total Comprehensive Income for the period [comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	2,989.46	2,179.02	5,105.05	3,825.46	8,207.78
6	Paid-up Equity Share Capital (Face value Re.1/-each)	1,389.32	1,376.02	1,389.32	1,376.02	1,376.02
7	Reserves (excluding Revaluation Reserve)					75,542.52
8	Earning per Equity Share (Face value Re.1/-each)					
	(a) Basic	1.90*	1.42*	3.25*	2.57*	5.37
	(b) Diluted	1.89*	1.41*	3.24*	2.54*	5.31
	(*Not annualised)					

Notes:

- The key standalone financial information of the Company is as under:

(₹ in Lacs)

S. No.	Particulars	Quarter Ended		Half Year Ended		Year Ended
		30-Sep-25	30-Sep-24	30-Sep-25	30-Sep-24	31-Mar-25
		(Unaudited)		(Unaudited)		(Audited)
1	Total Income from Operations	26,978.31	23,467.42	51,958.17	45,156.66	91,326.13
2	Net Profit for the period before Tax (after Exceptional Items)	3,976.87	3,108.01	6,983.58	5,321.62	10,925.46
3	Net Profit for the period after Tax	2,996.45	2,255.83	5,138.17	3,947.49	8,345.78

- The Unaudited financial results for the quarter and six months ended September 30, 2025 were reviewed by the Audit Committee at its meeting held on November 11, 2025 and have been approved by the Board of Directors of the Company at its meeting held on November 11, 2025.

- The above is an extract of the detailed format of quarter and six months ended September 30, 2025 financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The full format of the quarter and six months ended September 30, 2025 financial results (Consolidated/ Standalone) are available on the Stock Exchange websites [National Stock Exchange of India Limited (www.nseindia.com) & BSE Limited (www.bseindia.com)] and on the Company's website (www.artemishospitals.com/investors). The same can also be accessed by scanning the Quick Response (QR) code provided below:



For and on behalf of the Board of Directors of
Artemis Medicare Services Limited
Sd/-
Onkar Kanwar
Chairman

Place : Gurugram
Date : November 11, 2025

ZAGGLE PREPAID OCEAN SERVICES LIMITED

CIN: L65999TG2011PLC074795

Regd Off: 15th Floor, Western Block, Vamsiram - Suvarna Durga Tech Park, Nanakramguda Village,
Serilingampally Mandal, GHMC Serilingampally Circle, Ranga Reddy, Telangana, 500032.
email id: accounts.hyd@zaggle.in

**STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS OF
ZAGGLE PREPAID OCEAN SERVICES LIMITED (COMPANY) FOR THE QUARTER
AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2025.**

The Board of Directors of the Company at their meeting held on November 11, 2025, have approved the Standalone and Consolidated Unaudited Financial Results of the Company for the quarter and half year ended September 30, 2025.

The aforementioned Financial Results along with Limited Review Reports issued by the Statutory Auditor of the Company are available on Company's website at <https://ir.zaggle.in/financials/> and can also be accessed by scanning the Quick Response (QR) Code given below:



Place : Hyderabad
Date : 11-11-2025

By Order of the Board
For Zaggle Prepaid Ocean Services Limited
Sd/-
Raj P Narayanam
Executive Chairman
DIN: 00410032

**Popular Vehicles & Services**

Popular Vehicles and Services Limited

Regd. Office: Kuttukaran Centre, Mamangalam, Cochin, Ernakulam-682 025, Kerala, India
CIN: L50102KL1983PLC003741, Website: www.popularmaruti.com, E-mail ID: cs@popularv.com. Telephone: +91 484 2341134

**STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS
(STANDALONE & CONSOLIDATED) FOR THE
QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2025**

The Board of Directors of the Company, at the meeting held on November 10, 2025 approved Un-Audited Financial Results of the Company for the quarter and half year ended September 30, 2025. ("Financial Results")

Financial results along with the Limited Review Report have been posted on the Company's website at <https://www.popularmaruti.com/investor-relations/financials/> and can be accessed by scanning the QR Code.

Place : Kochi
Date : 10 November 2025

For and on behalf of the Board of Directors
SD/-
Naveen Philip
Managing Director (DIN: 00018827)

**Sun Pharma Advanced Research Company Limited**

Regd. Office: Plot No. 586/1, Savli GIDC Estate, Manjusr 391775,

District: Vadodara, Gujarat, India

Corporate Office: 17-B, Mahal Industrial Estate, Mahakali Caves Road, Andheri (E), Mumbai 400 093.

Tel: (91-22) 6645 5685 CIN: L73100GJ2006PLC047837

Website: www.sparc.life Email: secretarial@sparcmail.com**Unaudited Financial Results for the Quarter and Half Year Ended September 30, 2025**

The Unaudited Financial Results of Sun Pharma Advanced Research Company Limited ("SPARC") for the quarter and half year ended September 30, 2025 ("Q2 FY 26 Results") have been filed with the Stock Exchanges as per Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Q2 FY 26 Results are available on Company's website, <https://sparc.life>, and also on the websites of the Stock Exchanges, i.e., www.bseindia.com and www.nseindia.com

For and on behalf of the Board

Dilip S. Shanghvi
Chairman
Kerala, November 10, 2025

Scan the Quick Response
(QR) code to access the
Q2 FY 26 Result.

**INDIA PESTICIDES LIMITED**

CIN No.: L24112UP1984PLC006894

Regd. Office: 35-A, Civil Lines, Bareilly - 243 001, Uttar Pradesh, India. Tel: +91 0581 2567459

Corporate Office: Water Works Road, Swarn Cold Storage Compound, Aishbagh, Lucknow - 226 004, Uttar Pradesh
Tel: +91 0522 2653602 Email: investor@indiapesticideslimited.com Web: www.indiapesticideslimited.com

**EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS
FOR THE QUARTER ENDED 30TH SEPTEMBER, 2025**

(Rs. in Crore)

Sl. No.	Particulars	Quarter Ended 30.09.2025 (Unaudited)	Quarter Ended 30.06.2025 (Unaudited)	Quarter Ended 30.09.2024 (Unaudited)	Half Year Ended 30.09.2025 (Unaudited)	Half Year Ended 30.09.2024 (Unaudited)	Year Ended 31.03.2025 (Audited)
1.	Total Income from operations	290.36	275.18	228.78	565.54	449.15	828.61
2.	Net Profit/ (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items)	47.00	47.08	33.60	94.10	60.28	111.37
3.	Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	47.00	47.08	33.60	94.10	60.28	111.37
4.	Net Profit/ (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	31.61	34.91	25.91	66.54	45.39	82.18
5.	Total comprehensive income for period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	31.59	34.89	25.91	66.52	45.44	82.14
6.	Equity Share Capital	11.52	11.52	11.52	11.52	11.52	11.52
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year						886.89
8.	Earning Per Share (Face Value of Rs. 1 each) (Not annualised)						
	1. Basic	2.75	3.03	2.25	5.78	3.94	7.14
	2. Diluted	2.75	3.03	2.25	5.78	3.94	7.14

KEY HIGHLIGHTS OF STANDALONE FINANCIAL RESULTS

(Rs. in Crore)


Sl. No.	Particulars	Quarter Ended 30.09.2025 (Unaudited)	Quarter Ended 30.06.2025 (Unaudited)	Quarter Ended 30.09.2024 (Unaudited)	Half Year Ended 30.09.2025 (Unaudited)	Half Year Ended 30.09.2024 (Unaudited)	Year Ended 31.03.2025 (Audited)
1.	Total Revenue from Operations	289.63	275.41	228.78	565.03	449.15	829.02
2.	Profit before tax	47.52	47.62	34.26	95.13	61.67	113.57
3.	Profit after tax	32.04	35.38	26.48	67.42	46.53	84.37
4.	Total Comprehensive Income	32.01	35.36	26.48	67.40	46.58	84.33

Notes: (1) The above is an extract of the Un-audited financial results for the quarter & half year ended 30th September, 2025 which have been reviewed by the Audit Committee and approved by Board of Directors at their meeting held on 11th November, 2025, and have been reviewed by Statutory Auditors and filed with the stock exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulation 2015, as amended. The full format of the aforesaid financial results is available on the website of the Company, (www.indiapesticideslimited.com), National Stock Exchange of India Limited (www.nseindia.com) and BSE Limited (www.bseindia.com) respectively. (2) The comparative figures have been regrouped/reclassified, wherever necessary to make them comparable with current period.



Place: Lucknow
Date: 11.11.2025

For and on Behalf of the Board
India Pesticides Limited
Sd/-
Dr. Kuruba Adeppa
Whole- Time Director
DIN 08987462



E2E Networks Limited

CIN:- L72900DL2009PLC341980

Awfis, 1st Floor, A-24/9, Mohan Cooperative Industrial Estate,
Mathura Road, New Delhi-110044, Phone No. +91-11-4084-4964
Email: cs@e2enetworks.com, Website https://www.e2enetworks.com/

Statement of Un-Audited Standalone Financial Results
for the quarter ended September 30, 2025.

The Un- audited Standalone Financial Results for the quarter ended September 30, 2025 ("Financial Results") have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company in their respective meetings held on Tuesday, November 11, 2025.

The full formal of Financial Results is available on the website of Stock Exchange at www.nseindia.com and also on the Company's website at <https://www.e2enetworks.com/investors/financial-information> and can be assessed by scanning the QR code.



For E2E Networks Limited
Sd/-
Srishti Baweja
Whole Time Director
DIN: 08057000

Date: November 11, 2025,
Place: New Delhi



S CHAND AND COMPANY LIMITED

Registered Office: A-27, 2nd Floor, Mohan Co-operative Industrial Estate, New Delhi-110044, India
Email: investors@schandgroup.com; Website: www.schandgroup.com; Phone: +91 11 49731800
Fax: +91 11 49731801; CIN: L22219DL1970PLC005400

Extracts of the Unaudited Standalone and Consolidated Financial Results for the
quarter and half year ended 30th September, 2025

(₹ in millions)							
S. No.	Particulars	Standalone			Consolidated		
		Quarterly		Year Ended	Quarterly		Year ended
		September 30, 2025	September 30, 2024	March 31, 2025	September 30, 2025	September 30, 2024	March 31, 2025
		Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited	Audited
1	Total Income from operations	253.76	335.86	3,099.16	517.83	396.36	7,326.97
2	Profit/(loss) before exceptional items and tax	(199.04)	(115.35)	312.53	(709.33)	(675.79)	928.36
3	Profit/(loss) before tax	(199.04)	(115.35)	223.63	(709.33)	(675.79)	928.36
4	Profit/(loss) for the period/year (after tax)	(139.12)	(85.84)	157.37	(535.94)	(527.68)	602.32
5	Total comprehensive income for the period /year (comprising profit/(loss) and other comprehensive income for the period/year)	(134.74)	(88.54)	153.36	(536.01)	(533.01)	595.12
6	Equity Share capital	176.36	176.09	176.25	176.36	176.09	176.25
7	Reserves and surplus (excluding Revaluation Reserves) of the previous year	NA	NA	8,416.09	NA	NA	9,726.54
8	Earnings/(loss) per share (in ₹)						
	- Basic	(3.94)	(2.44)	4.47	(14.96)	(14.67)	18.04
	- Diluted	(3.94)	(2.44)	4.46	(14.96)	(14.67)	18.03


Notes:

1. The above is an extract of detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of The SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Company's website www.schandgroup.com and on the website of BSE Limited (www.bseindia.com) and The National Stock Exchange of India Limited (www.nseindia.com).

2. The unaudited standalone and consolidated financial results for the quarter and half year ended September 30, 2025 were reviewed by the Audit Committee at its meeting held on November 11, 2025 and have been approved and taken on record by the Board of Directors at its meeting held on November 11, 2025.

For and on behalf of the Board of Directors
S Chand And Company Limited
Sd/-
Himanshu Gupta
Managing Director
DIN: 00054015

Date: November 11, 2025
Place: New Delhi



ARTEMIS MEDICARE SERVICES LIMITED

CIN: L85110DL2004PLC126414

Regd. Office : Plot No.14, Sector 20, Dwarka, South West Delhi, Delhi- 110075
Ph.: +91-124-4511111
Email: investor@artemishospitals.com; | Website: www.artemishospitals.com

EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND
SIX MONTHS ENDED SEPTEMBER 30, 2025

(₹ in Lacs)						
S. No.	Particulars	Quarter Ended		Half Year Ended		Year Ended
		30-Sep-25	30-Sep-24	30-Sep-25	30-Sep-24	31-Mar-25
		(Unaudited)		(Unaudited)		(Audited)
1	Total Income from Operations	27,470.28	24,142.14	52,966.37	46,462.52	93,691.67
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	3,937.58	3,055.36	6,916.02	5,219.27	10,766.58
3	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	3,937.58	3,055.36	6,916.02	5,219.27	10,766.58
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	3,000.22	2,213.07	5,119.97	3,865.50	8,217.62
5	Total Comprehensive Income for the period [comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	2,989.46	2,179.02	5,105.05	3,825.46	8,207.78
6	Paid-up Equity Share Capital (Face value Re.1/-each)	1,389.32	1,376.02	1,389.32	1,376.02	1,376.02
7	Reserves (excluding Revaluation Reserve)					75,542.52
8	Earning per Equity Share (Face value Re.1/-each)					
	(a) Basic	1.90*	1.42*	3.25*	2.57*	5.37
	(b) Diluted	1.89*	1.41*	3.24*	2.54*	5.31
	(*Not annualised)					

Notes:

1. The key standalone financial information of the Company is as under: (₹ in Lacs)

S. No.	Particulars	Quarter Ended		Half Year Ended		Year Ended
		30-Sep-25	30-Sep-24	30-Sep-25	30-Sep-24	31-Mar-25
		(Unaudited)		(Unaudited)		(Audited)
1	Total Income from Operations	26,978.31	23,467.42	51,958.17	45,156.66	91,326.13
2	Net Profit for the period before Tax (after Exceptional Items)	3,976.87	3,108.01	6,983.58	5,321.62	10,925.46
3	Net Profit for the period after Tax	2,996.45	2,255.83	5,138.17	3,947.49	8,345.78

2. The Unaudited financial results for the quarter and six months ended September 30, 2025 were reviewed by the Audit Committee at its meeting held on November 11, 2025 and have been approved by the Board of Directors of the Company at its meeting held on November 11, 2025.

3. The above is an extract of the detailed format of quarter and six months ended September 30, 2025 financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarter and six months ended September 30, 2025 financial results (Consolidated/ Standalone) are available on the Stock Exchange websites [National Stock Exchange of India Limited (www.nseindia.com) & BSE Limited (www.bseindia.com)] and on the Company's website (www.artemishospitals.com/investors). The same can also be accessed by scanning the Quick Response (QR) code provided below:

Place : Gurugram
Date : November 11, 2025

For and on behalf of the Board of Directors of
Artemis Medicare Services Limited
Sd/-
Onkar Kanwar
Chairman

ZAGGLE PREPAID OCEAN SERVICES LIMITED

CIN: L65999TG2011PLC074795

Regd Off: 15th Floor,Western Block, Vamsiram - Suvarna Durga Tech Park, Nanakramguda Village,
Serilingampally Mandal, GHMC Serilingampally Circle, Ranga Reddy, Telangana, 500032.
email id: accounts.hyd@zaggle.in

STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS OF
ZAGGLE PREPAID OCEAN SERVICES LIMITED (COMPANY) FOR THE QUARTER
AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2025.

The Board of Directors of the Company at their meeting held on November 11, 2025, have approved the Standalone and Consolidated Unaudited Financial Results of the Company for the quarter and half year ended September 30, 2025.

The aforementioned Financial Results along with Limited Review Reports issued by the Statutory Auditor of the Company are available on Company's website at <https://ir.zaggle.in/financials/> and can also be accessed by scanning the Quick Response (QR) Code given below:



By Order of the Board
For Zaggle Prepaid Ocean Services Limited
Sd/-
Raj P Narayanam
Executive Chairman
DIN: 00410032

Place : Hyderabad
Date : 11-11-2025



Popular Vehicles & Services

Popular Vehicles and Services Limited

Regd. Office: Kuttukaran Centre, Mamangalam, Cochin, Ernakulam-682 025, Kerala, India
CIN: L50102KL1983PLC003741, Website: www.popularmaruti.com, E-mail ID: cs@popularv.com, Telephone: +91 484 2341134

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS
(STANDALONE & CONSOLIDATED) FOR THE
QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2025

The Board of Directors of the Company, at the meeting held on November 10, 2025 approved Un-Audited Financial Results of the Company for the quarter and half year ended September 30, 2025. ("Financial Results")

Financial results along with the Limited Review Report have been posted on the Company's website at <https://www.popularmaruti.com/investor-relations/financials/> and can be accessed by scanning the QR Code.

For and on behalf of the Board of Directors
SD/-
Naveen Philip
Managing Director (DIN: 00018827)

Place : Kochi
Date : 10 November 2025





Sun Pharma Advanced Research Company Limited

Regd. Office: Plot No. 586/1, Savli GIDC Estate, Manjusrar 391775,
District: Vadodara, Gujarat, India

Corporate Office: 17-B, Mahal Industrial Estate, Mahakali Caves Road, Andheri (E), Mumbai 400 093.
Tel: (91-22) 6645 5685 CIN: L73100GJ2006PLC047837
Website: www.sparc.life Email: secretarial@sparcmail.com

Unaudited Financial Results for the Quarter and Half Year Ended September 30, 2025

The Unaudited Financial Results of Sun Pharma Advanced Research Company Limited ("SPARC") for the quarter and half year ended September 30, 2025 ("Q2 FY 26 Results") have been filed with the Stock Exchanges as per Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Q2 FY 26 Results are available on Company's website, <https://sparc.life>, and also on the websites of the Stock Exchanges, i.e., www.bseindia.com and www.nseindia.com

For and on behalf of the Board
Dilip S. Shangkhi
Chairman
Kerala, November 10, 2025

Scan the Quick Response (QR) code to access the Q2 FY 26 Result.





INDIA PESTICIDES LIMITED

CIN No.: L24112UP1984PLC006894

Regd. Office: 35-A, Civil Lines, Bareilly - 243 001, Uttar Pradesh, India. Tel: +91 0581 2567459
Corporate Office: Water Works Road, Swarup Cold Storage Compound, Aishbagh, Lucknow - 226 004, Uttar Pradesh
Tel: +91 0522 2853602 Email: investor@indiapesticideslimited.com Web: www.indiapesticideslimited.com

EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS
FOR THE QUARTER ENDED 30TH SEPTEMBER, 2025

(Rs. in Crore)							
Sl. No.	Particulars	Quarter Ended 30.09.2025 (Unaudited)	Quarter Ended 30.06.2025 (Unaudited)	Quarter Ended 30.09.2024 (Unaudited)	Half Year Ended 30.09.2025 (Unaudited)	Half Year Ended 30.09.2024 (Unaudited)	Year Ended 31.03.2025 (Audited)
1.	Total Income from operations	290.36	275.18	228.78	565.54	449.15	828.61
2.	Net Profit/ (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items)	47.00	47.08	33.60	94.10	60.28	111.37
3.	Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	47.00	47.08	33.60	94.10	60.28	111.37
4.	Net Profit/ (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	31.61	34.91	25.91	66.54	45.39	82.18
5.	Total comprehensive income for period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	31.59	34.89	25.91	66.52	45.44	82.14
6.	Equity Share Capital	11.52	11.52	11.52	11.52	11.52	11.52
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year						886.89
8.	Earning Per Share (Face Value of Rs. 1 each) (Not annualised)						
	1. Basic	2.75	3.03	2.25	5.78	3.94	7.14
	2. Diluted	2.75	3.03	2.25	5.78	3.94	7.14

KEY HIGHLIGHTS OF STANDALONE FINANCIAL RESULTS (Rs. in Crore)

Sl. No.	Particulars	Quarter Ended 30.09.2025 (Unaudited)	Quarter Ended 30.06.2025 (Unaudited)	Quarter Ended 30.09.2024 (Unaudited)	Half Year Ended 30.09.2025 (Unaudited)	Half Year Ended 30.09.2024 (Unaudited)	Year Ended 31.03.2025 (Audited)
1.	Total Revenue from Operations	289.63	275.41	228.78	565.03	449.15	829.02
2.	Profit before tax	47.52	47.62	34.26	95.13	61.67	113.57
3.	Profit after tax	32.04	35.38	26.48	67.42	46.53	84.37
4.	Total Comprehensive Income	32.01	35.36	26.48	67.40	46.58	84.33

Notes: (1) The above is an extract of the Un-audited financial results for the quarter & half year ended 30th September, 2025 which have been reviewed by the Audit Committee and approved by Board of Directors at their meeting held on 11th November, 2025, and have been reviewed by Statutory Auditors and filed with the stock exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulation 2015, as amended. The full format of the aforesaid financial results is available on the website of the Company, (www.indiapesticideslimited.com), National Stock Exchange of India Limited (www.nseindia.com) and BSE Limited (www.bseindia.com) respectively. (2) The comparative figures have been regrouped/reclassified, wherever necessary to make them comparable with current period.

Place: Lucknow
Date: 11.11.2025

For and on Behalf of the Board
India Pesticides Limited
Sd/-
Dr. Kuruba Adeppa
Whole- Time Director
DIN 08987462



Ahmedabad